

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૨/૦૫/૨૦૧૭ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૨૩/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૨ કેસ કરી, ૨૧ વ્યક્તિઓને ઝડપી, ૬૪ લીટર દેશી દારૂ, ૬૪૦ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૯૩૦ ક્વોટર ઈંગ્લીશ દારૂ અને ૧૦૨ બીયરટીન કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૨૪/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

દુષ્ક્રિયાની ફરીયાદ :-

સમાચાર યાદી નં.૯૨૫/૧૭

નિકોલ : નીતાબેન તે અમરતભાઈ ધનાભાઈ કમાણીયા(રાવળ)ની વિધવા પત્ની (રહે,શુરભી રેસીડેન્સી વિભાગ-૦૧ નિકોલ ગામ રોડ) એ તા.૦૧/૫/૧૭ નારોજ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આશરે બે માસ અગાઉ થી તા.૨૯/૪/૧૭ સુધીનાં સમયગાળા દરમિયાન આરોપી (૧) રાજેન્દ્રસિંહ રાજપુત (રહે.મધુર પેટ્રોલપંપ, હિરાવાડી) (૨) પલક બારોટ અને તેનો ભાઈ જે.પી.એન્ટર પ્રાઇઝ, ભિંડ ભંજન રોડ) (૩) અમરતભાઈ દેસાઈ (રહે,તક્ષશિલા સ્કુલ સામે) અને (૪) અમીત (રહે. ઇ-કોલોની, બાપુનગર ગવર્મેન્ટ કોલોની) ભેગામળી નીતાબેનનાં પતિ અમરતભાઈ (ઉ.વ.૪૦) એ વ્યાજ લીધેલા પૈસા ચુકવવા છતાં વધુ પૈસા બળજબરીથી કઢાવવા સારૂ અમરતભાઈને જાનથી મારી નાંખવાની ધાક-ધમકીઓ આપી આપઘાત કરવા મજબૂર કરતાં, અમરતભાઈએ તા.૨૯/૪/૧૭ રાતનાં ૯/૪૫ વાગ્યાનાં સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એન.એન.પારગી ચલાવે છે.

વટવા : લલવીદાબેન વા/ઓ જોગીન્દર રાજભાર (રહે,ગંગાનગર આશાપુરી રેસીડેન્સી સામે સવિતાનગર ની બાજુમાં વટવા) એ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૫/૧૭ ના કલાક ૧૧/૦૦ થી બપોરના ૧/૩૦ વાગ્યા દરમ્યાન પોતાનાં મકાનનું તાળું તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૫૮,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.જી.વસાવા ચલાવે છે.

આત્મહત્યા:-

શાહીબાગ (૧) : જયંતીભાઈ બબાભાઈ રાઠોડ (ઉ.વ.૫૦)(રહે,સરકારી અનાજ ગોડાઉનની ચાલી શાહીબાગ) એ કોઈ અગમ્ય કારણસર તા.૦૧/૦૫/૧૭ ના કલાક ૦૦/૦૫ વાગ્યાનાં સુમારે પોતાના ઘરે પોતાની જાતે એસીડ પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એચ.ઝાલા ચલાવે છે.

શાહીબાગ (૨) : ધર્મિષ્ઠાબેન W/O વિનોદભાઈ પરમાર (ઉ.વ.૩૨) (રહે,પ્રીતમપુરા સોસાયટી ગીરધરનગર શાહીબાગ) એ કોઈ અગમ્ય કારણસર તા.૦૧/૦૫/૧૭ ના કલાક ૧૨/૦૫ વાગ્યાનાં સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.પો.કમિ.શ્રી “એફ” ડીવીઝન ચલાવે છે.

શાહીબાગ (૩) : મધુબેન W/O શ્રીકાંતભાઈ ગોહીલ (ઉ.વ.૫૫)(રહે,પ્રેમ સોસાયટી, સુજાતા ફ્લેટની પાછળ શાહીબાગ) એ કોઈ અગમ્ય કારણસર તા.૦૧/૦૫/૧૭ બપોરના ૦૨/૩૦ વાગ્યાનાં સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એ.પટેલ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.